

# મોનનો મેની ફેસ્ટો....


ગણલ

કેદ માટે જ અંગ બદલે છે  
જીવ કેવળ સુરંગ બદલે છે  
હું તને આગામું કઈ રીતે ?  
દરવખત રૂપરંગ બદલે છે  
આંસુ ખારા જ છે સદીઓથી  
સ્વાદ તો બસ પ્રસંગ બદલે છે  
છો કરે કોઈ કાંકરીયાણો , -  
જળ કદી કૃચાં તરંગ બદલે છે  
જાત બદલી શકે તો બદલી લે  
આંગળીમાં શું નંગ બદલે છે ?

ડૉ. અશોક ચાવડા 'બેદિલ'

આત્મખોજ જરૂરી છે. આપણને જન્મ આપ્યો છે એટલે  
બધું જ જન્મ આપણાર પર છોડી દેવું કેટલું વાજભી છે ?  
કવિતામાં ગુફાતાપ અને જીવનનું સત્ત્વ બંને એકાકાર અને  
એકમેવ છે. આપણું શરીર આપણા નામથી ઓળખાય છે.  
લોકોએ પારેલા નામથી આપણે આપણા શરીરને ઓળખીએ  
છીએ. 'આપણને' કેટલા ઓળખીએ છીએ ? આપણને  
ઓળખતા થઈશું ત્યારે આત્માએ ધારણ કરેલા આપણા  
શરીરથી નાતો બંધાશે. શુભમાંથી શુદ્ધ તરફની ગતિ થશે.  
પ્રસ્તુત ગગલની બહેર ટૂંકી અને બારીકી  
ગહેરી છે. આપણે આપણા અંગથી  
ઓળખાઈએ છીએ. આ શરીર પણ  
આત્માનું અંગ છે અને જીવ સુરંગની  
જેમ એક પછી એક 'આપણને' બદલ્યા  
કરે છે.

જેને રૂપરંગ છે એ પણ દરવખત રૂપરંગ બદલે છે. અને  
જેને રૂપ-રંગથી ઓળખવા માંગીએ છીએ એ પણ રૂપરંગ  
બદલીને આપણાથી સંતુક્કડી રમે છે. આંખોનું વિસ્મય  
ટકાવી રાખવા માટે ક્યારેક ઉદાસ અને ક્યારેક શાંત થઈને  
કિનારાની જેમ તથાવના પાણીની ચહેર-પહુલ મમળાવવી  
જોઈએ ! તો જ આંસુના રંગમાં પ્રસંગનો સ્વાદ મમળાવવાનું  
મન થાય ! આંસુ તો સદીઓથી ખારાં જ છે. સ્વાદ પ્રસંગ  
પ્રમાણે બદલાય છે. દુઃખનું ખાનું એક જ છે. સુખનાં  
સરનામાં શોધવાની જરૂર પડે છે ! એટલે જ કાંકરીયાણો  
પાણીમાં કરવાથી તરંગનો આકાર ગોળાકરમાંથી ચોરસ કે  
ત્રિકોણ થવાનો નથી ! સ્વભાવ બદલાતો નથી, અભાવને



કારણે મહોરં પહેરી લેતો હોય છે ! એટલે જ છેલ્લા શેરમાં  
કવિ જ્યોતિષની વાતને આગવી ચિંતનશૈલીથી નવાજે છે.  
નંગ બદલવાથી ગ્રહો કે સમય નહીં બદલાય ! જાતને  
બદલવાથી બધું ઠીરીઠામ થવાનું છે ! જાતને બદલવાની એટલે  
અભિપ્રાય આપવામાં ઉતાવળા ન થાય અને ઉતાવળા થઈને  
અભિપ્રાય ન આપવો ! જાતને બદલવાની એટલે આપણા

સ્વાર્થ માટે બીજાનો રસ્તો અટકાવીને  
આગળ ન વધવું તે ! નંગ બદલવાથી  
સારો સમય આવતો હોય તો જેટલા  
જ્યોતિષ છે તે તે બધા જ ફરિયાદ કર્યા  
વગર જીવન જીવતા હોત !

## જીવનના હકારની કવિતા

અકિલ ત્રિયેદી

પ્રસ્તુત આખી ગગલ પ્રત્યેક શેરના અલગ  
ભાવવિશ્વમાં પણ પ્રત્યેક શેર સાથેના ખેચે છે.  
અશોક ચાવડા 'બેદિલ' ગુજરાતી ગગલના નોંધપાત્ર  
મુકાભોમાંનો આગવો મુકામ છે. જિંગળીએ અને કવિતાની  
નજીક અને શંભોથી દૂર રાખ્યો છે. સાચો કવિ બોલે ત્યારે  
મૌન સંભળાતું હોય છે. કવિના અવાજને તાળીઓના  
અવાજને સોંપીને ઘણા કવિઓ પાસેથી કવિતાદેવીએ  
ધાથતાથી આપી દીધી છે ત્યારે અશોક કવિતાને જીવનની  
જેમ અને જીવનને કવિતાની જેમ જીવે છે. 'જીવનના  
હકારની આ કવિતા' કભીરના તાણાવાણા શરીર-સાથે  
મેળવીને જીવતી જાગતી કવિતા છે, જેમાં નામ વગરનો  
સંબંધ મૌનનો મેનીકેસ્ટો બની ગયો છે....